

શિક્ષણ વિદ્યાર્થાખા : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી – જૂનાગઢ
બી.એડ. : દ્વિવર્ષીય અભ્યાસક્રમ : સેમેસ્ટર -4

Sub Code	Subject Name	Hours	Credit	Internal	External	Total
CC6	અધ્યયન માટેનું મૂલ્યાંકન	90	6	30	70	100
CC7	જ્ઞાન અને અભ્યાસક્રમ	90	6	30	70	100
CC8	સમાવેશી શાળા	45	3	15	35	50
CC9	ICT	45	3	15	35	50
EPC 3	સ્વની સમજ	45	3	15	35	50
EC 5.1	પર્યાવરણ શિક્ષણ	45	3	15	35	50
EC 5.2	કારક્રિય માર્ગદર્શન અને સલાહ					
EC 5.3	ભારતીય શિક્ષણ પ્રણાલી					
EC 5.4	સ્વાસ્થ્ય અને શા.શિ. અંતર્ગત યોગ					
SSC 5	જૂથ-૧	45	3	15	35	50
SSC 6	જૂથ-૨	45	3	15	35	50
	TOTAL	450	30	150	350	500

પ્રેક્ટિકલ વર્ક

Assignment / Task / Practical Work-Semester - 4

Sr.No.	Title	Hours	Credit	Internal	External	Total
1	EPC-4 માહિતી અને પ્રત્યાયન તકનિકી (ICT) (40 Practical + 35 MCQ Paper)	90	6	0	75	75
2	વાર્ષિક પાઠ (1 +1)	45	3	0	50	25 + 25
	TOTAL	135	9	0	125	125

શિક્ષણ વિદ્યાર્થીઓ : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી – જૂનાગઢ

બી.એડ. : દ્વિવર્ષીય અભ્યાસક્રમ : સેમેસ્ટર – 4

પ્રશ્નપત્ર ક્રમાંક :	અધ્યયન માટેનું મૂલ્યાંકન Assessment for Learning	કુલ ગુણ : 100 Credit : 6 Hours : 90
----------------------	---	---

હેતુઓ

પ્રશિક્ષણાર્થી.....	<ul style="list-style-type: none"> – માપન અને મૂલ્યાંકનનો પરિચય મેળવે. – શૈક્ષણિક આંકડાશાસ્ત્રની જુદી જુદી પ્રયુક્તિઓ વિશે સમજે અને તેની ગણતરીઓ કરે. – શૈક્ષણિક આંકડાશાસ્ત્રની વિવિધ પ્રયુક્તિઓ સંદર્ભે ગણતરીઓ કરે. – સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન વિશે સમજે. – વિદ્યાર્થીઓને મૂલ્યાંકનને આધારે પ્રતિપોષણ આપે. – વિદ્યાર્થીઓ માટે સંગૃહિત પ્રગતિપત્રકના પરિમાણો વિશે સમજે.
---------------------	--

ઓકમ ક્રમાંક	સૈદ્ધાંતિક કાર્ય	અધ્યયન અધ્યાપન પ્રક્રિયા	ગુણભાર
1	શૈક્ષણિક માપન અને મૂલ્યાંકન		25%
	1.1 માપન અને મૂલ્યાંકનનો અર્થ અને તે બંને વચ્ચેનો તંશાવત 1.2 મૂલ્યાંકનની અધ્યયનમાં રચનાત્મક તરાખો 1.3 અધ્યયન મૂલ્યાંકન અને અધ્યયન માટેની મૂલ્યાંકન વચ્ચેનો તંશાવત 1.4 મૂલ્યાંકનના હેતુઓ 1.5 પ્રવર્તમાન મૂલ્યાંકનની તાર્કિક સમીક્ષા 1.6 મૂલ્યાંકન, માપન, વિકાસ, ગુણાંકન અને પરીક્ષણનું સ્પષ્ટીકરણા	– ચર્ચા પદ્ધતિ – સ્વાધ્યાય – સ્વઅધ્યયન – અનુભવ – ચાર્ટર્સ નિર્માણ	
2	શૈક્ષણિક આંકડાશાસ્ત્ર		25%
	2.1 શૈક્ષણિક આંકડાશાસ્ત્રની સંકલ્પના અને શિક્ષક માટે ઉપયોગિતા 2.2 આવૃત્તિ વિતરણ અને તેના પર આધારિત આલોખના સ્તરોની આવૃત્તિ બહુકોણ 2.3 મધ્યવર્તી સ્થિતિનાં માપ : સંકલ્પના અને ગણતરી (મધ્યક, મધ્યસ્થ અને બહુલક) 2.4 ચલિતતાનાં માપ : સંકલ્પના અને ગણતરી (વિસ્તાર, પાદસ્થ વિચલન અને પ્રમાણ વિચલન)	– પરિસંવાદ – જૂથચર્ચા – કાર્યશાળા – ટીમટીચિંગ	

3	સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન		25%
	3.1 શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનની સંકલપના અંતર્ગત SA, FA 3.2 શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન સ્વરૂપ અને મહત્વ	- ચર્ચા	
4	પ્રતિપોષણ અને અહેવાલ		25%
	4.1 વિકાસાત્મક અને સ્વ મૂલવણીમાં પ્રતિપોષણ એક જરૂરી ઘટક તરીકે. 4.2 મૂલ્યાંકનમાં પ્રતિપોષણનો ઉપયોગ : અધ્યાપન શાસ્ત્ર, નિર્ણય પ્રક્રિયા, સલાહ અને પ્રેરણા 4.3 શિક્ષક પ્રતિપોષણના પ્રકારો : લેખિત, મૌખિક, વિવેચનાત્મક 4.4 અધ્યોત્તાની સર્વગ્રાહી પ્રોફાઈલનો વિકાસ અને જાળવણી 4.5 અધ્યાપનશાસ્ત્રના ભવિષ્યના નિર્ણયના આધારરૂપે પ્રતિપોષણ 4.6 અધ્યોત્તા પ્રોફાઈલનો સંગૃહિત અહેવાલ	- નિર્દર્શ પાઠ, જૂથકાર્ય અને સિમ્બુલેશન. - કાર્યશાળા - નિરીક્ષિત - સ્વાધ્યાય	

પ્રાયોગિક કાર્ય (કોઈ ઓક)

- 1 ઉત્તર બુનિયાદી વિદ્યાલયના કોઈ ઓક ધોરણના શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનનો અભ્યાસ કરવો.
- 2 દસ સ્થાનિક પાઠ કે ચર્ચા પાઠનું નિરીક્ષણ કરી સહપાઠીને મૌખિક અને લેખિત પ્રતિપોષણ આપે.
- 3 શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનના FA વિભાગનો લેખિત સ્વાધ્યાય તૈયાર કરવો.
- 4 કોઈ બે વર્ગના પરિણામોની સરાસરી અને પ્રમાણ વિચલન ગણી તુલના કરવી.
- 5 કોઈ એક શાળાના એક વર્ગના પરિણામ પરથી ત્રણ વિષયોના પ્રાપ્તાંકોની આલોખાત્મક રજૂઆત કરવી.

સંદર્ભ સૂચિ

1. Arunima Kumari (2008). An Introduction to Research Methodology. Udaipur : ATPA.
2. Tom, Kubiszyn and Gary Bosich. (1990). Educational Testing and Measurment. USA : Harper Collins Publication.
3. એટ્પા એસ.પી.(1999). આધુનિક માપન તથા મૂલ્યાંકન ઇલાહાબાદ : શારદા પુસ્તક અવન.
4. પાઠક પી.ડી. ભારતીય શિક્ષા ઔર ડસકી સમસ્યાએ. આ.રા : વિનોદ પુસ્તક મંદિર.
5. ઉચાટ ડી. એ.(2009). શિક્ષણ અને સામાજિક વિજ્ઞાનોમાં સંશોધન પદ્ધતિશાસ્ત્ર સાહિત્ય મુદ્રણાલય, પ્રા.લિ.
6. અંબાસણા, અનિલ. મનોવૈજ્ઞાનિક કસોટીની સંરચના. રાજકોટ : શિક્ષણશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી.

7. ત્રિવેદી મનુભાઈ અને પારેખ બી. યુ. (1994). શિક્ષણમાં આંકડાશાસ્ત્ર અમદાવાદ : યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ.
8. પટેલ, મોતીભાઈ અને અન્ય.(2008). અધ્યયન – અધ્યાપન પ્રક્રિયા તથા શૈક્ષણિક માપન અને મૂલ્યાંકન અમદાવાદ : બી.એસ.શાહ પ્રકાશન.
9. પટેલ, આર. એસ.(2008). શૈક્ષણિક સંશોધન માટે આંકડાશાસ્ત્રીય પદ્ધતિ અમદાવાદ : જ્ય પલ્બિકેશન.
10. શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન, ગાંધીનગર : માધ્યમિક શિક્ષણ બોર્ડ.
11. શેઠ, બી.એમ. અને અન્ય(1976). મનોવિજ્ઞાનમાં આંકડાશાસ્ત્ર, અમદાવાદ : યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ.

શિક્ષણ વિદ્યાર્થીઓ : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી – જૂનાગઢ

બી.એડ. : દ્વિવર્ષીય અભ્યાસક્રમ : સેમેસ્ટર -4

પ્રશ્નપત્ર ક્રમાંક :	જ્ઞાન અને અભ્યાસક્રમ Knowledge and Curriculum	કુલ ગુણ : 100 Credit : 6 Hours : 90
----------------------	--	---

હેતુઓ

પ્રશિક્ષણાર્થી.....	<ul style="list-style-type: none"> – વિદ્યાર્થીઓ શિક્ષણના જ્ઞાનાત્મક આધારની સમજ કેળવે. – શિક્ષણ અને જ્ઞાન નિર્માણની આધુનિક પદ્ધતિઓની સમજ કેળવે. – જ્ઞાન પ્રાપ્તિના વિવિધ સ્ત્રોતો અને શિક્ષણના સામાજિક આધારો વિશે સમજે. – લોકતાંત્રિક સમાજ નિર્માણમાં શિક્ષણની ભૂમિકા.
---------------------	--

એકમ ક્રમાંક	સૈદ્ધાંતિક કાર્ય	અધ્યયન અધ્યાપન પ્રક્રિયા	ગુણભાર
1	શિક્ષણના જ્ઞાનાત્મક આધાર		25%
	1.1 શિક્ષણના વિવિધ આધારો : <ul style="list-style-type: none"> (1) તાત્ત્વિક : ગાંધીજી, ટાગોર (જ્ઞાનનું સ્વરૂપ, અભ્યાસક્રમ, શાળા, શિક્ષક, પદ્ધતિ, શિસ્ત) (2) સામાજિક : ડૉ. આંબેડકર, જે. કૃષ્ણમૂર્તિ (જ્ઞાનનું સ્વરૂપ, અભ્યાસક્રમ, શાળા, શિક્ષક, પદ્ધતિ, શિસ્ત) 1.2 જ્ઞાનાત્મક આધાર : કેટલીક સંકલ્પનાઓ <ul style="list-style-type: none"> – જ્ઞાન અને કૌશલ્ય – જ્ઞાન અને માહિતી – શિક્ષણ અને પ્રશિક્ષણ – તક (reason) અને માન્યતા (belief) 	<ul style="list-style-type: none"> – જૂથચર્ચા – પરિસંવાદ – ટીમટિચીંગ – વ્યાખ્યાન 	
2	શિક્ષણ અને જ્ઞાન નિર્માણની આધુનિક પદ્ધતિઓ		25%
	2.1 બાળકેન્દ્રી શિક્ષણ, પ્રવૃત્તિ કેન્દ્રી (સંકલ્પના, પ્રકાર, ઉપયોગિતા અને આ સંદર્ભે મહત્વા ગાંધીના વિચાર) 2.2 શોધ કેન્દ્રીત (સંકલ્પના, પ્રકાર, ઉપયોગિતા અને આ સંદર્ભે ડયૂઈના વિચાર) 2.3 સંવાદ કેન્દ્રીત (સંકલ્પના, પ્રકાર, ઉપયોગિતા અને આ સંદર્ભે પ્લેટો અને ગાંધીના વિચાર)	<ul style="list-style-type: none"> – કાર્યશાળા – પરિસંવાદ – વ્યાખ્યાન 	

3	પ્રવર્તમાન ભારતીય સમાજમાં શિક્ષણ		25%
	3.1 સમાજ અને શિક્ષણ 3.2 સંસ્કૃતિ અને શિક્ષણ 3.3 આધુનિકતા અને શિક્ષણ	- જૂથચર્ચા - પરિસંવાદ - વ્યાખ્યાન	
4	સમાજવાદી સમાજ અને શિક્ષણ		25%
	4.1 લોકશાહી અને શિક્ષણ 4.2 વ્યક્તિ સ્વતંત્ર અને શિક્ષણ 4.3 ઔદ્યોગિકીકરણ અને શિક્ષણ	- પ્રોજેક્ટ - પરિસંવાદ - ચર્ચા સભા	

પ્રાયોગિક કાર્ય (કોઈ એક)

- 1 ઘોરણ 6 થી 8ના કોઈપણ એક પાઠ્યપુસ્તકની સમીક્ષા.
- 2 કોઈ એક ગામની મુલાકાત લઈ સમાજ નવરચના માટે સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ (પ્રાર્થના, સફાઈ, પ્રદર્શન ઈત્યાદિ) દ્વારા ક્ષેત્રકાર્ય કરી અહેવાલ તૈયાર કરે.
- 3 સમાજમાં પ્રવર્તમાન મહત્વપૂર્ણ ઘટનાઓ પર જૂથચર્ચા કરી શિક્ષકની ભૂમિકાનો ઝ્યાલ મેળવી અહેવાલ રજૂ કરે.
- 4 સર્વધર્મ સમભાવના વિકાસમાં શિક્ષણની ભૂમિકા ઉપર ચર્ચાસભાનું આયોજન કરી અહેવાલ તૈયાર કરે.

સંદર્ભ સૂચિ

1. મદાન, પૂ. (2014). શિક્ષા કે દર્શાનિક એવં સાજશાસ્ત્રીય આધાર. આગરા : અગ્રવાલ પબ્લિકેશન.
2. રહેલા, એસે.પી.(2014). શિક્ષા કેદર્શાનિક એવં સાજશાસ્ત્રીય આધાર. આગરા : અગ્રવાલ પબ્લિકેશન.
3. દુબે, એસ.પી.(2014). પાઠ્યકન્મ કા વિકાસ. ઇલહાબાદ : શારદા પુસ્તકલ પ્રકાશન.
4. રાવલ, ન. વિ. (2011), કેળવણીની તાત્ત્વિક અને સમાજશાસ્ત્રીય અધારશીલાઓ, અમદાવાદ : નીરવ પ્રકાશન
5. Wiles Jon, W. and Bondi, J. C. (2014). Curriculum Development : A Guide to Practice (9e) : Pearson Higher Ed USA
6. Hilda & Taba (1962). Curriculum Development : Theory and Practice, Harcourt, Brace & World.
7. Dewey, J. (2004), Democracy and Education. Courier Dover Publications.
8. Batra, P. (2005). Voice and agency of Teachers : Missing link in national curriculum framework (2005). Economic and Political Weekly, 4347 – 4356.
9. NCERT (2000). National Curriculum Framework for school education. New Delhi : NCERT.
10. NCERT (2005). National Curriculum Framework for school education. New Delhi : NCERT.
11. NCERT (2009). National Curriculum Framework for Teacher education. New Delhi : NCERT.

શિક્ષણ વિદ્યાર્થીઓ : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી – જૂનાગઢ

બી.એડ. : દ્વિવર્ષીય અભ્યાસક્રમ : સેમેસ્ટર -4

પ્રશ્નપત્ર ક્રમાંક :	સમાવેશી શાળા નિર્માણ Creating an Inclusive School	કુલ ગુણા : 50 Credit : 3 Hours : 45
----------------------	--	---

હેતુઓ

પ્રશિક્ષણાર્થી.....	<ul style="list-style-type: none"> – સમાવેશી શિક્ષણ વિશેની સમજ કેળવે. – વિભિન્ન પ્રકારની વિકલાંગતા વિશે સમજે. – સમાવેશી શિક્ષણ અંગે વિવિધ સંસ્થાઓના યોગદાનથી પરિચિત થાય. – બાળ અધિકારો વિશે સમજ કેળવે. – સમાવેશી શિક્ષણ સંદર્ભે વિવિધ જોગવાઈઓ/ભલામણોની સમજ કેળવે. – સમાવેશી શિક્ષણ સંદર્ભે માતા-પિતા, શિક્ષક, વહીવટકર્તા અને સમાજની ભૂમિકા વિશે સમજ કેળવે.
---------------------	--

ઓકમ ક્રમાંક	સૈદ્ધાંતિક કાર્ય	અધ્યયન અધ્યાપન પ્રક્રિયા	ગુણભાર
1	સમાવેશી શિક્ષણ		25%
	1.1 સમાવેશી શિક્ષણની સંકલ્પના, લાક્ષ્ણિકતા અને મહત્વ 1.2 વિભિન્ન પ્રકારની વિકલાંગતા – અંધ – મૂક બધીર – શારીરિક વિકલાંગ – માનસિક વિકલાંગ	<ul style="list-style-type: none"> – પરિસંવાદ – મુલાકાત – જૂથ ચર્ચા 	
2	બાળ અધિકારો સંદર્ભે વિવિધ સંસ્થાઓનો પરિચય		25%
	2.1 RCI (Rehabilitation Council of India) ભારતીય પુનઃ સ્થાપના પરિષદ 2.2 NCPNR (National Commission for protection of Child Rights) રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ 2.3 બાળ અધિકારો સંદર્ભે યુનેસ્કો સંમેલન : 1989 2.4 વિકલાંગોના અધિકારો સંદર્ભે યુનેસ્કો સંમેલન : 2006	<ul style="list-style-type: none"> – સ્વાધ્યાય – પરિસંવાદ 	

3	સમાવેશી શિક્ષણ સંદર્ભે ગુણવત્તા સુધારણા		25%
	3.1 શિક્ષણનો અધિકાર : 2009માં સમાવેશી શિક્ષણ અંગેની ભલામણો 3.2 સર્વશિક્ષા અભિયાનમાં સમાવેશી શિક્ષણની સંકળપના અને કાર્યક્રમો 3.3 સંકલિત બાળવિકાસ યોજના (ICDS)	- સ્વાધ્યાય - પરિસંવાદ	
4	સમાવેશી શિક્ષણ સંદર્ભે ભૂમિકા		25%
	4.1 શિક્ષકની ભૂમિકા 4.2 માતા-પિતાની ભૂમિકા 4.3 વહીવટકર્તાની ભૂમિકા 4.4 સમાજની ભૂમિકા	- મુલાકાત - ચર્ચા સમા	

પ્રાયોગિક કાર્ય (કોઈ ઓક)

- 1 અંધજન મંડળની મુલાકાત લઈ ફોટોગ્રાફ સાથે અહેવાલ તૈયાર કરવો.
- 2 બહેરા-મુંગાની શાળાની મુલાકાત લઈ ફોટોગ્રાફ સાથે અહેવાલ તૈયાર કરવો.
- 3 માનસિક વિકલાંગ બાળકોની સંસ્થાની મુલાકાત લઈ ફોટોગ્રાફ સાથે અહેવાલ તૈયાર કરવો.
- 4 વિવિધ પ્રકારના વિકલાંગોને ઉપયોગી વેબસાઈટની પાઠી તૈયાર કરવી. RCI (Rehabilitation Council of India). NCPCR (National Commission for Protection of Child Rights)

સંદર્ભ સૂચિ

1. Booth, T., Ainscow, M., Black-hawkins, K., Vaughan, M., & Shaw, L. (2000). Index for inclusion : Developing Learning and participation in school. Centre for Studies on Inclusive Education.
2. COI. (1986). National policy of education. COI.
3. COI. (2009). The right of children to free and compulsory education act. 2009 http://mhrd.gov.in/sites/upload_files/mhrd/files/rte.pdf
4. COI. (2011). Sarva shiksha abhiyan – Framework for implimentation based on the right of children to free and compulsory education act, 2009, COI
5. [http://www.upefa.com/upefawed/admin/myupload/SSA_Frame_work_\(revised\)_9-6-2011.pdf](http://www.upefa.com/upefawed/admin/myupload/SSA_Frame_work_(revised)_9-6-2011.pdf).
6. UNESCO. (1989). UN convention on the rights of the children. UNESCO.
7. UNESCO. (2006). United Nations convention on the rights of persons with disabilities. UNESCO.
8. UNESCO. (2009). Policy guidelines on incursion in education. UNESCO.

શિક્ષણ વિદ્યાર્થીઓ : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી – જૂનાગઢ

બી.એડ. : દ્રિવધીય અભ્યાસક્રમ : સેમેસ્ટર – 4

પ્રશ્નપત્ર ક્રમાંક : CC - 9	Critical Understanding of ICT	કુલ ગુણા : 50 Credit : 3 Hours : 45
---------------------------------------	----------------------------------	--

હેતુઓ

પ્રશિક્ષણાર્થી.....	<ul style="list-style-type: none"> - To develops skill to perform practicals on computer. - To aware basic peripherals of computer. - Usage of computer in education & analysis - Practically perform installation & other utilities. - To perform practical work in Word, Excel, Powerpoint & Usage in education
----------------------------	--

ઓક્સ ક્રમાંક	ચૈદાંતિક કાર્ય	અધ્યયન અધ્યાપન પ્રક્રિયા	ગુણભાર
1	Computer Basic		20%
	1.1 Computer generatiuns. 1.2 Concept of Software & Hardware 1.3 Types of computers. 1.4 Input and Output devices 1.5 Storage : Units, devices (CD, DVD, Blu-ray, Pendrive, Hard disk)	- Demostration	
2	Operating System		20%
	2.1 Microsoft Windows 7 2.2 Desktop typical window, File and Folder management. 2.3 Network : meaning types. 2.4 Android : History, Version (Name only)	- Presitation	
3	Office – 2007		30%
	3.1 MS Word – 2007 : Typical window, working with document, Formatting, Fonts, Printing. 3.2 Ms Excel – 2007 : Typical window, working with formula (sum, max, min, result, rank, gread) 3.3 MS Power Point – 2007 : Typical window, making presentation, inserting, sound, vedio file, animation.	- Presitation - Assgnment	

4	Productivity Tools		30%
	4.1 Internet : meaning, history, merits & demerits. 4.2 Google input tools Gujarati : installation and working with it. 4.3 Google services : Gmail, G Drive, Google Docs, Google map (Introduction and Uses) 4.4 Blogging : Step to create new blog.	- Presitation - Assgnment	

પ્રાયોગિક કાર્ય (કોઈ એક)

- 1 કમ્પ્યુટરની પાયાની છિયાઓનું વિવિધ ભાષામાં પેરેશાફ ટાઈપ કરી ફોર્મેટીંગ કરવું.
- 2 સ્પ્રેડશીટ સોફ્ટવેરની મદદથી ૧૦ વિદ્યાર્થીનું પરિણામપત્રક તૈયાર કરવું.
- 3 ઇન્ટરન્શીપ કાર્યકમનું અહેવાલ લેખન વર્ડમાં તૈયાર કરવું.
- 4 પોતાના કોઈ એક વિષયનું કોઈ એક એકમનું પ્રોજેક્ટ તૈયાર કરવું.

સંદર્ભ સૂચિ

1. April, Marine & others Internet : getting started, New Jersey : PTR Prentice Hall, Englewood cliffs.
2. Brenden Tangney (1998), Local area Networks and their applications. UK : Brenden Tangney prentice Hall, International LTD.
3. Chauhan, N. B. & Others, Information Technology for Agricultural Production, Education & Management. Delhi : Satish serial publishing house Express tower, Azadpur.
4. Julio sanchez, Maria P. canton(1992), IBM micro computer Assembly L. in 10 programming lesson. New Jersey : prentice Hall, Englewood cliffs.
5. Mujibul Hasan Siddiqui (2007), Technology in Teacher Education. New Delhi : APH Publishing corporation Ansari Road, Dariya ganj.
6. T.M.Samuel, maria Samuel (2008), Handbook of I.T. New Delhi : Commonwealth publication Ansari road.
7. V.P.Ramanujam (1st edition 2001), Computer education. New Delhi : Amittal publication, Dariya ganj.
8. અંબાસણા અનિલ, નેટવર્ક ટેકનોલોજી, રાજકોટ : શિક્ષણશાસ્ત્ર ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
9. અંબાસણા અનિલ, તમારા કમ્પ્યુટરને ઓળખો, રાજકોટ : શિક્ષણશાસ્ત્ર ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
10. www.gujaratvidyapith.org
11. www.gseb.org
12. www.gcrt.gujarat.gov.in
13. www.ncert.org
14. <http://nroer.gov.in>

શિક્ષણ વિદ્યાશાખા : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી – જૂનાગઢ

બી.એડ. : દ્વિવર્ષીય અભ્યાસક્રમ : સેમેસ્ટર – 4

પ્રશ્નપત્ર ક્રમાંક :	'સ્વ' ની સમજ Understanding of Self	કુલ ગુણા : 50 Credit : 3 Hours : 45
----------------------	---------------------------------------	---

હેતુઓ

પ્રશિક્ષણાર્થી.....	<ul style="list-style-type: none"> – 'સ્વ'ની અને બીજાની માન્યતાઓ, ધારણાઓ, લાગણીઓ અને મહત્વકાંક્ષાઓને સમજે. – 'સ્વ'નું વિશ્લેષણ, સ્વમૂલ્યાંકન, સંજોગો/પરિસ્થિતિ સાથે અનુકૂલન થવાની સમજ અને ક્ષમતા વિકસે. – 'સ્વ'ની તથા વિદ્યાર્થીઓની ક્ષમતાઓ તથા મર્યાદાઓ ઓળખે અને તેને અનુરૂપ સર્જનાત્મક બનવાની તથા મૌલિક બનવાની ક્ષમતા વિકસાવી વ્યક્તિત્વ ઘડતર અંગે સમજ કેળવે. – વ્યક્તિગત અને સામુદ્રાયિક સંગઠન ક્ષમતા (Team building). કર્તવ્યનિષ્ઠા, અન્યો માટેની જવાબદારી અને સંઘર્ષ વિશેની સમજ કેળવે. – સામાજિક માળખાને સમજે અને સમાનતા, લોકશાહી અને સામાજિક ન્યાય પ્રત્યે સંવેદનશીલતા કેળવે.
---------------------	--

ઓકમ ક્રમાંક	સૈદ્ધાંતિક કાર્ય	અધ્યયન અધ્યાપન પ્રક્રિયા	ગુણભાર
1	પ્રશિક્ષણાર્થી તરીકે 'સ્વ' અને અન્યની ઓળખ		25%
	1.1 'સ્વ'ની ઓળખ અને જરૂરિયાતોની સમજ (સુખ અને સુવિધા) 1.2 'સ્વ'ની માન્યતાઓ અને જાણકારી 1.3 'સ્વ'ના અનુભવો 1.4 'સ્વ' અને અન્યની લાગણીઓ તથા મહત્વકાંક્ષાઓ (વ્યક્તિગત અને શિક્ષક બનવાની મહત્વકાંક્ષાઓ)	<ul style="list-style-type: none"> – સંવાદ દ્વારા – સંવાદ દ્વારા ઉદાહરણો દ્વારા – પ્રતિભાવો દ્વારા (લેખિત/મૌખિક) – કાર્યશિબિર દ્વારા 	
2	પરિવાર અને સમાજમાં સંવાદિતા – પ્રશિક્ષણાર્થી સંદર્ભે		25%
	2.1 પરિવારમાં સંવાદિતા અંગેની સમજ 2.2 વિશ્વાસનો અર્થ વિશ્વાસ વધારવાની સમજ 2.3 શાળામાં પરિવારના રૂપમાં સંવાદિતા 2.4 સમાજમાં સંવાદિતા અંગેની સમજ (પરિવાર થી વૈશ્વિક પરિવાર સુધી સંવાદિતા)	<ul style="list-style-type: none"> – ચર્ચા – સ્વ અનુભવો અને પ્રેરણા – સમૂહજીવનનાં કાર્યો (પ્રાર્થના, સર્કારી, રસોઈ) – કાર્ય વહેચણી અને અમલ 	

3	પ્રશિક્ષણાર્થીનું વ્યક્તિત્વ ઘડતર અને મૂલ્યો		25%
	3.1 વ્યક્તિગત ઘડતરની સંકલ્પના 3.2 'સ્વ'નું વ્યક્તિત્વ ઘડતર અને શિક્ષકનું વ્યક્તિત્વ ઘડતર 3.3 શિક્ષકનાં મૂલ્યોની સંકલ્પના અને સ્વરૂપ 3.4 શિક્ષક તરીકે લોકશાહીના, નૈતિકતાના અને સામાજિક મૂલ્યો	- ચર્ચા - કાર્ય શિબિર - સ્વાધ્યાય - ચાર્ટસ, પ્રદર્શન - મૂલ્યલક્ષી કાર્યક્રમો	
4	સામાજિક પરિવર્તનના ક્ષેત્રે સર્જનશીલતાનો વિકાસ		25%
	4.1 શિક્ષક દ્વારા સામાજિક પરિવર્તન 4.2 પ્રત્યાયનકાર તરીકેની ભૂમિકા 4.3 ડર અને પૂર્વગ્રહરહિત વાતાવરણ નિર્માણની સમજ 4.4 વિદ્યાર્થીઓની સર્જનશીલતાનો વિકાસ (નાટકો, કલા, સંગીત, કારીગરી, વિવિધ સ્પર્ધાઓનું આયોજન)	- જૂથચર્ચા - તજજ્ઞનું વક્તવ્ય - અનુભવોનું વર્ણન - નાટક, કલા - વેસ્ટમાંથી બેસ્ટ - વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ	

પ્રાયોગિક કાર્ય (કોઈ એક)

1	સવની ઓળખ માટે કાર્યશિબિરનું આયોજન કરી જૂથકાર્યમાં જોડાવવું.
2	છાત્રાલયમાં એક પરિવારના રૂપમાં સંવાદિતા સ્થાપિત કરવા, આયોજન બનાવીને અમલ કરવો.
3	સમાજમાં માનવમૂલ્યો પ્રસ્થાપિત કરવા માટે વિવિધ મૂલ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવું.
4	કાર્યશિબિરના સંદર્ભે ચાર્ટ બનાવી પ્રદર્શન ગોઠવવું.

સંદર્ભ સૂચિ

1.	Gaur, R. R., Sangal, R., 8 Bangaria, G. P. Human Values & Professional ethics.
2.	ના રાજ, એ. માનવ વ્યવહાર દર્શન, સરદાર શહર (રાજસ્થાન), વિદ્યામંદિર
3.	મહેતા, બબલભાઈ, સમૂહજીવનનો આચાર, નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ

શિક્ષણ વિદ્યાશાખા : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી – જૂનાગઢ

બી.એડ. : દ્વિવર્ષીય અભ્યાસક્રમ : સેમેસ્ટર – 4

પ્રશ્નપત્ર ક્રમાંક :	પર્યાવરણ શિક્ષણ Environment Education	કુલ ગુણ : 50 Credit : 3 Hours : 45
----------------------	--	--

હેતુઓ

પ્રશિક્ષણાર્થી.....	<ul style="list-style-type: none"> – પર્યાવરણ શિક્ષણ અને જાળવણીને સમજે. – પર્યાવરણમાં પ્રદૂષણની સમસ્યાઓ અને તેના કારણો અને ઉપાયોને જાણો. – પર્યાવરણીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના કાર્યની સમજ મેળવે. – જૈવિક વૈવિધ્ય અને પર્યાવરણ વચ્ચેનો સબંધ સમજે. – પર્યાવરણ શિક્ષણના અભ્યાસક્રમ અને પર્યાવરણ સંરક્ષણને સમજે. – પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમો યોજી શકે. – પર્યાવરણ જાગૃતિ અંગે શિક્ષકની ભૂમિકાને જાણો.
---------------------	--

ઓક્સ ક્રમ ક્રમાંક	સૈદ્ધાંતિક કાર્ય	અધ્યયન અધ્યાપન પ્રક્રિયા	ગુણભાર
1	પર્યાવરણ શિક્ષણ અને જાળવણી		25%
	1.1 પર્યાવરણનો અર્થ 1.2 પર્યાવરણ શિક્ષણની વિભાગના 1.3 કુદરતી સ્ત્રોતની જાળવણી (પાણી, જમીન અને જંગલોની જાળવણી)	– પ્રવાસ – પ્રોજેક્ટ – નિર્દર્શન	
2	પ્રદૂષણ : સમસ્યાઓ તેના કારણો અને ઉપાયો		25%
	2.1 વૈશ્વિક સમસ્યાઓ – ગ્રીન હાઉસ ઈફેક્ટ – ઓઝોન પટમાં છિદ્રો – એસિડ રેઇન 2.2 સ્થાનિક સમસ્યાઓ – ક્ષાર પ્રવેશની સમસ્યાઓ – ધરતીકંપ અને સુનામી – અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ 2.3 પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના કાર્યો(રાજ્ય સ્તરે)	– પ્રોજેક્ટ – પ્રત્યક્ષ મુલાકાત – ઓડીયોવિઝયુઅલ નિર્દર્શન	
3	જૈવિક વૈવિધ્ય		25%
	3.1 જૈવિક વૈવિધ્ય અને પર્યાવરણ વચ્ચેનો સબંધ 3.2 જૈવિક વૈવિધ્ય પર ખતરો 3.3 જૈવિક વૈવિધ્યનું સંરક્ષણ માટેના પ્રયાસો અને તે માટે કાર્યરત સંસ્થાઓ (ગુજરાત સ્તરે)	– પ્રવાસ – પ્રોજેક્ટ – નિર્દર્શન	

4	પર્યાવરણ શિક્ષણ અભ્યાસક્રમ અને પર્યાવરણ સંરક્ષણ		25%
	<p>4.1 માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે પર્યાવરણ શિક્ષણનાં હેતુઓ</p> <p>4.2 માધ્યમિક કક્ષાના વિદ્યાર્થીઓ માટે પર્યાવરણનાં અભ્યાસક્રમમાં સમાવિષ્ટ બાબતો</p> <p>4.3 પર્યાવરણ શિક્ષણનો અન્ય વિષય સાથે અનુબંધ</p> <p>4.4 માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમો</p> <p>4.5 પર્યાવરણ જાગૃતિ અંગે શિક્ષકની ભૂમિકા</p>	<ul style="list-style-type: none"> - પ્રવાસ - પ્રોજેક્ટ - નિર્દર્શન - અભ્યાન 	

પ્રાયોગિક કાર્ય (કોઈ ઓક)

- | | |
|---|---|
| 1 | પર્યાવરણની જાગૃતિ માટે રેલીનું આયોજન. |
| 2 | કોલેજ કક્ષાએ સેમિનાર યોજવો. |
| 3 | પર્યાવરણને લગતી વિવિધ સ્પર્ધાઓનું આયોજન. |
| 4 | પર્યાવરણ સાથે સંલગ્ન વિવિધ સંસ્થાઓની મુલાકાત. |
| 5 | પર્યાવરણ જાળવણી અંગે ડિઝેટનું આયોજન. |
| 6 | શાળા કક્ષાએ પર્યાવરણ ઇવસની ઉજવણી. |
| 7 | શાળા કક્ષાએ પર્યાવરણના લાભ-લાભ અંગેના મોડલ, ચાર્ટ, ફિલ્મોનું નિર્દર્શન. |

સંદર્ભ સૂચિ

- | | |
|----|--|
| 1 | સંકલન ઈસાટ(1992) 'પર્યાવરણ રીયો-ડી-જાનવરોની પૃથ્વી' પરિષદ એકસપ્રેસ. |
| 2 | દિક્ષિત નિલેશ(1997). માનવ ભૂગોળ, યુનિ. ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુ.રા. |
| 3 | ત્રિવેદી મહેશ(1994). "માનવ અને પર્યાવરણ", ભૌગોલિક પરિપ્રેક્ષમાં, યુનિ. ગ્રંથ નિર્માણ બોર્ડ |
| 4 | પટેલ કેશવલાલ(1998). 'કુદરતી પર્યાવરણ' યુનિ. ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુ.રા. |
| 5 | ભાયાણી, રમેશ(1990). 'પ્રદૂષણ અને પર્યાવરણ', પ્રવિશ્બ પુસ્તક ભંડાર, રાજકોટ |
| 6 | પટેલ, મહેશ(2003). 'પર્યાવરણ', પોષ્યુલર પ્રકાશ, સુરત |
| 7 | ગોયલ એમ.કે.(2005). પર્યાવરણ અધ્યયન, વિનોદ પુસ્તક મંદિર, આગરા |
| 8 | શર્મા બી.ઓલ.(2007). 'પર્યાવરણ શિક્ષા' ઓપોલો પ્રકાશન, જયપુર |
| 9 | સંક્ષેપેના(1998). 'પર્યાવરણ શિક્ષા', આર્થ બુક ડિપો, નई દિલ્હી. |
| 10 | કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, દિલ્હી, 'પર્યાવરણ પ્રદૂષણ', વૈજ્ઞાનિક અને તકનિકી |
| 11 | www.biology.ariozna.edu |
| 12 | www.enaydopaedia.com |
| 13 | www.biology-online.org |
| 14 | www.nature.com |
| 15 | www.epa.gov |
| 16 | www.climatenews.com |
| 17 | www.law.pace.edu |

શિક્ષણ વિદ્યાર્થીઓ : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી – જૂનાગઢ

બી.એડ. : દ્વિવર્ષીય અભ્યાસક્રમ : સેમેસ્ટર – 4

પ્રશ્નપત્ર ક્રમાંક :	કારક્રિય માર્ગદર્શન	કુલ ગુણ : 50
EC – 5.2	Career Guidance	Credit : 3 Hours : 45

હેતુઓ

પ્રશિક્ષણાર્થી.....	<ul style="list-style-type: none"> – માર્ગદર્શનની સંકલ્પનાં સમજે. – માર્ગદર્શનનું શૈક્ષણિક મહત્વ સમજે. – કારક્રિય માર્ગદર્શનનાં સિદ્ધાંતો સમજે. – કારક્રિય માર્ગદર્શનનાં પ્રાપ્તિસ્થાનો જાણો. – કારક્રિય માર્ગદર્શનની જુદી જુદી પદ્ધતિઓથી પરિચિત થાય.
---------------------	--

એકમ ક્રમાંક	સૈદ્ધાંતિક કાર્ય	અધ્યયન અધ્યાપન પ્રક્રિયા	ગુણભાર
1	કારક્રિય માર્ગદર્શન		20%
	1.1 કારક્રિયનો અર્થ, કારક્રિય માર્ગદર્શન 1.2 સાંપ્રત પરિસ્થિતિમાં કારક્રિય માર્ગદર્શનની જરૂરિયાત 1.3 શૈક્ષણિક માહિતીનો અર્થ અને મહત્વ	<ul style="list-style-type: none"> – વ્યાખ્યાન – મૂલાકાત – ચર્ચા 	
2	કારક્રિય માર્ગદર્શનના સિદ્ધાંતો		20%
	2.1 કારક્રિય માર્ગદર્શનના સિદ્ધાંતો 2.2 માધ્યમિક / ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સ્તરે કારક્રિય માર્ગદર્શનના ધ્યેયો 2.3 કારક્રિય માર્ગદર્શક શિક્ષકની લાયકાતો અને ફરજો	<ul style="list-style-type: none"> – મૂલાકાત – પરિસંવાદ – સેમિનાર 	
3	કારક્રિય માહિતી : એકત્રીકરણ, ફાઈલીંગ અને વિતરણ		20%
	3.1 કારક્રિય માહિતીના પ્રકારો (પ્રાથમિક અને ગૌણ) 3.2 કારક્રિય માહિતીના પ્રાપ્તિસ્થાનો 3.3 કારક્રિય માહિતી એકત્રીકરણની રીતો 3.4 કારક્રિય માહિતીનું ફાઈલીંગ – પદ્ધતિઓ અને આદર્શ ફાઈલીંગના લક્ષણો 3.5 કારક્રિય માહિતી વિતરણની રીતો : કારક્રિય સપ્તાહ, કારક્રિય કોષ્ટ, વાર્તાલાપ અને કારક્રિય પ્રદર્શન	<ul style="list-style-type: none"> – સેમિનાર – વ્યાખ્યાન – સ્વાધ્યાય 	

4	કારક્ષી માર્ગદર્શનની પ્રયુક્તિઓ અને ઉપકરણો		20%
	4.1 કારક્ષી માર્ગદર્શનની પ્રયુક્તિઓ – પ્રશ્નાવલિ, અવલોકન, સામાજિકતામિતિ (સ્વરૂપ, ઉપયોગ, ફાયદા, મર્યાદા)	- કથન - પરિસંવાદ - જૂથ ચર્ચા - સ્વાધ્યાય	
	4.2 કારક્ષી માર્ગદર્શનના ઉપકરણો (અર્થ, સ્વરૂપ અને મહત્વ) મનોવૈજ્ઞાનિક કસોટીઓ, બુદ્ધિ કસોટી, અભિયોગ્યતા કસોટી, વ્યક્તિત્વમાપન કસોટી (ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ કસોટીનો પરિચય)		
	4.3 કારક્ષી માર્ગદર્શનમાં મનોવૈજ્ઞાનિક કસોટીના સંચાલન અને અર્થઘટનમાં ધ્યાનમાં રાખવાની બાબતો		
	4.4 સંગૃહિત માહિતી પત્રક સ્વરૂપ અને કારક્ષી માર્ગદર્શનમાં તેની ઉપયોગિતા		
5	કારક્ષી માર્ગદર્શન અને વ્યવહાર		20%
	5.1 ધોરણ 9માં ચાલતા 'કારક્ષી માર્ગદર્શન કાર્યક્રમ'નો પરિચય (તાસ આયોજન, તાસમાં અપાતી માહિતી અને અમદાવાદ સ્થિત વ્યાવસાયિક માર્ગદર્શન સંસ્થાનો પરિચય)	- મૂલાકાત - વ્યાખ્યાન - સ્વાધ્યાય	
	5.2 કારક્ષી માર્ગદર્શનમાં ટેક્નોલોજીનો વિનિયોગ દર્શય—શ્રાવ્ય સાધનો, સીડી, ઈન્ટરનેટ, સામયિકો અને પુસ્તકોના ઉપયોગ દ્વારા વ્યવસાયની પ્રાપ્ત તકો અને થતા ફાયદા		

પ્રાયોગિક કાર્ય (કોઈ એક)

- 1 ગુજરાત રાજ્યમાં કાર્યરત માર્ગદર્શન કેન્દ્રોની યાદી તૈયાર કરે.
- 2 ગુજરાત રાજ્યમાં કાર્યરત માર્ગદર્શન કેન્દ્રો પૈકી કોઈ એક કેન્દ્રની મૂલાકાત લઈ તેની પ્રવૃત્તિઓ અને કાર્યપ્રણાલી વિશે અહેવાલ તૈયાર કરે.
- 3 ધોરણ 12 પછી ઉચ્ચ અભ્યાસ માટેના કોઈ 10 ક્ષેત્રોની યાદી તૈયાર કરે.
- 4 શાળોય શિક્ષણ બાદ કારક્ષીના કોઈ દસ ક્ષેત્રોની યાદી તૈયાર કરે.
- 5 કોઈ એક વ્યાવસાયિક કેન્દ્રની મૂલાકાત લઈ અહેવાલ તૈયાર કરે.
- 6 ઈન્ટરન્શિપ દરમિયાન વિવિધ કસોટીઓ પૈકી શિક્ષક સૂચિત કોઈ એક કસોટીનો વિદ્યાર્થીઓ પર અજમાયસ કરી અહેવાલ તૈયાર કરે.
- 7 ઈન્ટરન્શિપ દરમિયાન અથવા ગ્રામ શિક્ષણ દરમિયાન માર્ગદર્શન અને સલાહદર્શન સંદર્ભે અધ્યાપક સૂચિત કોઈ એક પ્રવૃત્તિ યોજી અહેવાલ રજૂ કરે.

સંદર્ભ સૂચિ

1. ઓબરાય, એસ. સી. (1993). શૈક્ષિક તથા વ્યાવસાયિક નિર્દેશન એવ પરામર્શન, મેરઠ, લાયન બુક ડિપો.
2. મિશ્રા, એ. (2007). શૈક્ષિક તથા વ્યાવસાયિક નિર્દેશન, નર્સ દિલ્લી, ઓમેગા પબ્લિકેશન
3. યુગલ, એસ. (1973) નિર્દેશન એવ પરામર્શ. ચંદીગઢ, હરિયાણા હિન્દી ગ્રન્થ અકાદમી.
4. કર્મા, આર. એવ. ઉપાધ્યાય, આર. (1967). શૈક્ષણિક વ્યાવસાયિક નિર્દેશન, આગરા, વિનોદ પુસ્તક મંદિર
5. દેસાઈ, કે.જી. (1998). શૈક્ષણિક અને વ્યાવસાયિક માર્ગદર્શનની પ્રવિધિઓ (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય.
6. આચાર્ય, એમ. (2009). માર્ગદર્શન અને સલાહ, અમદાવાદ, અક્ષર પબ્લિકેશન.
7. Sharma, R. A. (2003). Fundamentals of Guidance and counseling. Meerut. Surya Publication.

શિક્ષણ વિદ્યાર્થીઓ : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી – જૂનાગઢ

બી.એડ. : દ્વિવર્ષીય અભ્યાસક્રમ : સેમેસ્ટર – 4

પ્રશ્નપત્ર ક્રમાંક :	ભારતીય શિક્ષણ પ્રણાલી Indian Education System	કુલ ગુણ : 50 Credit : 3 Hours : 45
----------------------	--	--

હેતુઓ

પ્રશિક્ષણાર્થી.....	– ભારતીય શિક્ષણ પ્રણાલીને સમજે. – વૈદિક, મુસ્લિમ, જૈન અને બૌધ્ધ શિક્ષણ પ્રણાલીને સમજે.
---------------------	---

ઓકમ ક્રમાંક	સૈદ્ધાંતિક કાર્ય	અધ્યયન અધ્યાપન પ્રક્રિયા	ગુણભાર
1	શિક્ષણ પ્રણાલી		25%
	1.1 વૈદિક શિક્ષણ 1.2 મુસ્લિમ શિક્ષણ 1.3 જૈન શિક્ષણ 1.4 બૌધ્ધિક શિક્ષણ	– વ્યાખ્યાન – સેમિનાર – પ્રોજેક્ટ	
2	સ્વતંત્રતા પહેલાના શિક્ષણપંચ		25%
	2.1 મેઝોલોની ભલામણ 2.2 વૃદ્ધનો ખરીતો 2.3 હન્ટર કમીશન–ભલામણ 2.4 લોર્ડ કાર્જોન પંચ	– કથન – સ્વાધ્યાય – પ્રોજેક્ટ – સેમિનાર	
3	સ્વતંત્રતા બાદના શિક્ષણપંચ		25%
	3.1 રાધાકૃષ્ણ પંચ (1948-49) 3.2 માધ્યમિક શિક્ષણપંચ (1952-53) 3.3 કોઠારી પંચ (1964-66) 3.4 1986 NPE ની શિક્ષણની મુખ્ય ભલામણ	– જૂથ ચર્ચા – સેમિનાર – વ્યાખ્યાન	
4	શિક્ષણની સંસ્થાઓ		25%
	4.1 MHRDના કાર્યો 4.2 UGCનો અવકાશ (કાર્યક્રોન) અને કાર્યો 4.3 NCTEનો પ્રાદેશિક સંસ્થામાં રોલ 4.4 NAAC : ગુણવત્તામાં નિયંત્રણ	– વર્કશોપ – જૂથ ચર્ચા – સેમિનાર – અસાઈમેન્ટ	

પ્રાયોગિક કાર્ય (કોઈ ઓક)

- | | |
|---|---|
| 1 | કોઈપણ સંસ્થાના NAAC-SSR રિપોર્ટનો અભ્યાસ કરે. |
| 2 | વૈદિક અને મુસ્લિમ શિક્ષણનો તુલનાત્મક અભ્યાસ. |

સંદર્ભ સૂચિ

- | | |
|----|---|
| 1. | Chaube, S.P. (1997). Philosophical and Sociological Foundation of Education. Ravi, Noudarnalya, 5 th rev. ed. Agra. |
| 2. | Lakshmi, T.K.S. and M.S.Yadav, "Education : its Evolving Characteristics", in New Frontiers in Education, Vol XXII, No. 4, Oct-Dec., 1992 |
| 3. | Mathur, S.S. (1997), Sociological Approach to Indian Education. Vinod Pustak Mandir, Agra, 10 th Ed. |
| 4. | Mohanty, Jagannath, Studies in Distance Education, Deep and Deep Publication Pvt. Ltd., New Delhi, 2001. |
| 5. | Pandey, R.S. (2001), Principles of Education. Vinod Pustak Mandir, Agra. |
| 6. | pandey, R.S. (1992), National Policy on Education, Horizon Publishers, Allahabad. |

શિક્ષણ વિદ્યાર્થીઓ : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી – જૂનાગઢ

બી.એડ. : દ્વિવર્ષીય અભ્યાસક્રમ : સેમેસ્ટર – 4

પ્રશ્નપત્ર ક્રમાંક :	સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ અંતર્ગત યોગ Physical and Health Underlying In Yog	કુલ ગુણા : 50 Credit : 3 Hours : 45
----------------------	---	---

હેતુઓ

પ્રશિક્ષણાર્થી.....	<ul style="list-style-type: none"> – શારીર અને મનના સ્વાસ્થ્ય માટે યોગશિક્ષણનું મહત્વ સમજે. – મહિષ પતંજલિએ અષ્ટાંગયોગમાં દર્શાવેલ ધર્મ અને નિયમ દ્વારા નૈતિક ગુણોનો વિકાસ કરે. – યોગસનો કરવાની પદ્ધતિ જાણી તે પ્રમાણે વિવિધ આસનો કરે અને તેનાથી થતા ફાયદાને સમજે. – પ્રાણાયામ કરવાની પદ્ધતિ જાણી તે પ્રમાણે વિવિધ પ્રાણાયામ કરે અને તેનાથી થતા ફાયદા વિશે સમજ કેળવે. – ધ્યાનનું મહત્વ સમજી ધ્યાન કરે અને તેના દ્વારા માનસિક શાંતિનો અનુભવ કરે. તણાવ થવા માટેના કારણો જાણી તેના નિવારણ માટેની પ્રક્રિયા સમજે.
---------------------	---

ઓકમ ક્રમાંક	સૈદ્ધાંતિક કાર્ય	અધ્યયન અધ્યાપન પ્રક્રિયા	ગુણભાર
1	સ્વાસ્થ્ય		25%
	1.1 સ્વાસ્થ્યનો અર્થ, વ્યાખ્યા 1.2 સ્વાસ્થ્યના પ્રકાર : શારીરિક, માનસિક અને સામાજિક 1.3 વ્યાયામ દ્વારા સ્વાસ્થ્ય વિકાસનું મહત્વ	– વ્યાખ્યાન – સેમિનાર	
2	પ્રાથમિક સારવાર		25%
	2.1 પ્રાથમિક સારવારનો અર્થ અને મહત્વ 2.2 રમત દરમ્યાન થતી શારીરિક ઈજાઓ અને તેની સારવાર 2.3 રમત ગમત દ્વારા માનસિક તનાવ મુક્તિ અંતર્ગત : નિખાલસતા, ખેલદીલી, સંઘભાવના, નિડરતા	– કથન – સ્વાધ્યાય	

3	યોગ અને પ્રાણાયામની સંકલ્પના		25%
	3.1 યોગ : અર્થ, સંકલ્પના અને મહત્વ 3.2 યોગની આઠ શીખ : અષ્ટાંગ યોગ 3.3 પ્રાણાયામ : અર્થ, સ્વરૂપ અને માનસ સાથે સંબંધ પ્રાણાયામના પ્રકાર : કપાલભાતી, ભર્ત્રીકા, સૂર્યભીન, ભ્રામરી, ચંદ્ર ભંદત, અનુલોમ વિલોમ	- જૂથ ચર્ચા - સેમિનાર	
4	ધ્યાન		25%
	4.1 ધ્યાનની સંકલ્પના, પ્રક્રિયા અને મહત્વ 4.2 માનસિક તણાવનો અર્થ, કારણો તણાવ યુક્તિમાં યોગની ભૂમિકા 4.3 પદ્માસન, વજાસન, તવાસન, સૂર્ય નમસ્કાર, ઉન્તાનપાદાસન, પલન પૂકૃતાસન, વક્કાસન, નવકાસન, ભૂજ્ઞકાંસન 4.4 સલભાસન, સર્વાગાસન, કલ્લાસન, ધનુરાસન, સવાસન	- વર્કશોપ - જૂથ ચર્ચા	

પ્રાયોગિક કાર્ય (કોઈ ઓક)

- 1 યોગકેન્દ્રની મુલાકાત લઈ તેમાં ચાલતી પ્રવૃત્તિઓની સમીક્ષા કરી અહેવાલ તૈયાર કરે.
- 2 વિવિધ પ્રકારના આસનોનું નિર્દર્શન કરે.
- 3 વિવિધ પ્રકારના પ્રાણાયામ અને ધ્યાનનું નિર્દર્શન કરે.
- 4 ધ્યાન કરવાની પ્રક્રિયા દરમિયાન થતા અનુભવો વિશે પ્રતિભાવો મેળવી અહેવાલ તૈયાર કરે.
- 5 શરીરના વિવિધ તંત્રો ઉપર યોગની અસર વિશે તજ્જશની મુલાકાત લઈ અહેવાલ તૈયાર કરે.

સંદર્ભ સૂચિ

- 1. સ્વામી અધ્યાત્માનંદજી (2008) : યોગ એ જ જીવન. અમદાવાદ : ગુજરાત ટાઈમ્સ પ્રકાશન.
- 2. રાવલ સી.સી. : યોગ અને સ્વાસ્થ્ય. અમદાવાદ : સ્વામી શિવાનંદ જ્ઞાનયજ્ઞનિધિ.
- 3. પટેલ શિવાભાઈ ઝવેરભાઈ (1983) : યોગાસન સેલ્ફ ટીચર, ચક્કાસી, જિ.ઝેડા, શિવાયોગનિકેતન
- 4. પટેલ માણેકલાલ મફતલાલ (1992) : 100 વર્ષ નીરોગી રહો., અમદાવાદ : ગૂર્જર ગ્રંથ કાર્યાલય
- 5. પટેલ માણેકલાલ મફતલાલ (1992) : સતત નીરોગી રહો., અમદાવાદ : ગૂર્જર ગ્રંથ કાર્યાલય
- 6. પટેલ સ્નેહલ (1998) : ઋષિ સંદેશ, અમદાવાદ : ઋષિ સાંસ્કૃતિક વિદ્યા કેન્દ્ર.
- 7. પટેલ છોટુભાઈ આર. (2001) : આસનો, યોગ અને અનુભવ, વલ્લભ વિદ્યાનગર : વલય પ્રકાશ. તૃતીય આવૃત્તિ.
- 8. સ્વામી આધ્યાત્મમાનંદ (2000) : યોગ અને આરોગ્ય, અમદાવાદ : ગૂર્જર ગ્રંથ રત્ન કાર્યાલય.
- 9. આચાર્ય વિષ્ણુપ્રસાદ અને આચાર્ય જનકભાઈ (2008) : યોગ અને આરોગ્ય, અમદાવાદ : યોગ એજયુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન.

10. સ્વામી વિવેકાનંદ (2004) : રાજ્યોગ, રાજકોટ : શ્રી રામકૃષ્ણ આશ્રમ.
11. શ્રી શ્રી રવિશંકર (2006) : યોગસાર ઉપનિષેદ, બેંગલોર : વ્યક્તિ વિકાસ કેન્દ્ર, ઈન્ડિયા, પબ્લિકેશન ડિવિઝન
12. પટેલ પ્રહલાદભાઈ આર. (2007) : વૈજ્ઞાનિક યોગ... પ્રાણાયામ, અમદાવાદ : વિશ્વ કલ્યાણ સંસ્થા.
13. પટેલ પ્રહલાદભાઈ આર. (2008) : નૈસર્જિક ધ્યાન—મેડિટેશન, અમદાવાદ : વિશ્વ કલ્યાણ સંસ્થા.
14. દેસાઈ દીપિ એમ. (1993) : ગૃહવિજ્ઞાન શિક્ષણ, અમદાવાદ : મયૂર પ્રકાશન
15. ભાષાદેવ (2002) : યોગ વિદ્યા, રાજકોટ : પ્રવીણ પુસ્તક ભંડાર.
16. પટેલ સતીશ (2004) : આરોગ્યની આસપાસ, ભાવનગર : ઈન્ડિયન મેડિકલ એસોસીએશન, મોરબી ખ્રાન્ય.
17. રાજલક્ષ્મી આર. (1978) : પ્રયુક્ત પોષણ, અમદાવાદ : યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ – ગુજરાત રાજ્ય.
18. વચ્છરાજાની ભદ્રાયુ (1994) : આહાર અને આરોગ્ય, અમદાવાદ : ગૂર્જર પ્રકાશન.
19. બિમાનજી યોગાચાર્યશ્રી (2003) : પ્રાણાયામ માર્ગદર્શિકા, અમદાવાદ : મહર્ષિ પતંજલિ યોગ સંસ્થાન.
20. બિમાનજી યોગાચાર્યશ્રી (2002) : યોગાસન માર્ગદર્શિકા.

શિક્ષણ વિદ્યાર્થીઓ : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી – જૂનાગઢ

બી.એડ. : દ્વિવર્ષીય અભ્યાસક્રમ : સેમેસ્ટર – 4

પ્રશ્નપત્ર ક્રમાંક :	ઈન્ફર્મેશન ટેકનોલોજીની વિવેચનાત્મક સમજ Critical Understanding of ICT	કુલ ગુણા : 75 Credit : 6 Hours : 90
----------------------	---	---

નોંધ

1	પ્રસ્તુત પ્રશ્નપત્રનું અધ્યયન અધ્યાપન નીચે દર્શાવ્યા પ્રમાણે ચારેય સત્ર દરમિયાન થશે.
2	પ્રસ્તુત પ્રશ્નપત્રનું અધ્યાપન–મૂલ્યાંકન સંપૂર્ણપણે પ્રાયોગિક પદ્ધતિએ થશે.
3	સૈદ્ધાંતિક બાબતોની સમજ માટે જરૂરી વ્યાખ્યાન, તજ્જીવ્ય વ્યાખ્યાન કે કાર્યશાળાનું આયોજન કરવામાં આવશે.
4	મૂલ્યાંકન માટે અભ્યાસક્રમમાં સમાવિષ્ટ બાબતોની પ્રાયોગિક પરીક્ષા લેવાશે.

હેતુઓ

પ્રશિક્ષણાર્થી.....	<ul style="list-style-type: none"> – ઈન્ફર્મેશન ટેકનોલોજી અને મલ્ટીમિડિયાનો શિક્ષણમાં ઉપયોગ સમજે. – ઈન્ફર્મેશન ટેકનોલોજીનું મહત્વ સમજે. – ઈન્ફર્મેશન ટેકનોલોજીનું શિક્ષણ ક્ષેત્રે ઉપયોજન કરે. – ઈન્ટરનેટનો શિક્ષણમાં ઉપયોગ કરે.
---------------------	---

ઓકમ ક્રમાંક	પ્રાયોગિક કાર્ય	ગુણભાર 75%
1	Type Action research report in word.	
2	Prepare result sheet in excel with formula	
3	Prepare Power Point presentation with animation.	
4	Google account creation.	
5	Create a Blog.	
6	Burning CD	
7	Creat PDF File.	
8	Printer & other utility software installation.	
9	Registration on IRCTC & Book your rail ticket.	

સંદર્ભ સૂચિ

1. April, Marine & others Internet : getting started, New Jersey : PTR Prentice Hall, Englewood cliffs.
2. Brenden Tangney (1998), Local area Networks and their applications. UK : Brenden Tangney prentice Hall, International LTD.
3. Chauhan, N. B. & Others, Information Technology for Agricultural Production, Education & Management. Delhi : Satish serial publishing house Express tower, Azadpur.
4. Julio sanchez, Maria P. canton(1992), IBM micro computer Assembly L. in 10 programming lesson. New Jersey : prentice Hall, Englewood cliffs.
5. Mujibul Hasan Siddiqui (2007), Technology in Teacher Education. New Delhi : APH Publishing corporation Ansari Road, Dariya ganj.
6. T.M.Samuel, maria Samuel (2008), Handbook of I.T. New Delhi : Commonwealth publication Ansari road.
7. V.P.Ramanujam (1st edition 2001), Computer education. New Delhi : Amittal publication, Dariya ganj.
8. અંબાસણા અનિલ, નેટવર્ક ટેકનોલોજી, રાજકોટ : શિક્ષણશાસ્ત્ર ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
9. અંબાસણા અનિલ, તમારા કમ્પ્યુટરને ઓળખો, રાજકોટ : શિક્ષણશાસ્ત્ર ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
10. www.gujaratvidyapith.org
11. www.gseb.org
12. www.gcetrgujarat.gov.in
13. www.ncert.org
14. <http://nroer.gov.in>

વિષયવસ્તુ અભ્યાસક્રમ

School Subject (SSC)

વિષય	સેમેસ્ટર - 1	સેમેસ્ટર - 2	સેમેસ્ટર - 4
ગુજરાતી	ધોરણ - 7નાં સેમ. - 1 અને 2 વ્યાકરણ પરિ. 1 મુજબ	ધોરણ - 8 નાં સેમ. - 1 અને 2 વ્યાકરણ પરિ. 1 મુજબ	ધોરણ - 9માંથી પાઠ 1 થી 12 પાઠ વ્યાકરણ પરિ. 1 મુજબ
હિન્દી	ધોરણ - 7નાં સેમ. - 1 અને 2 વ્યાકરણ પરિ. 2 મુજબ	ધોરણ - 8 નાં સેમ. - 1 અને 2 વ્યાકરણ પરિ. 2 મુજબ	ધોરણ - 9માંથી પાઠ 1 થી 12 પાઠ વ્યાકરણ પરિ. 2 મુજબ
સંસ્કૃત	ધોરણ - 7નાં સેમ. - 1 અને 2 વ્યાકરણ પરિ. 3 મુજબ	ધોરણ - 8 નાં સેમ. - 1 અને 2 વ્યાકરણ પરિ. 3 મુજબ	ધોરણ - 9માંથી પાઠ 1 થી 10 પાઠ વ્યાકરણ પરિ. 3 મુજબ
અંગ્રેજી	ધોરણ - 7નાં સેમ. - 1 અને 2 વ્યાકરણ પરિ. 4 મુજબ	ધોરણ - 8 નાં સેમ. - 1 અને 2 વ્યાકરણ પરિ. 4 મુજબ	ધોરણ - 9માંથી યુનિટ 1 થી 6 અને 1 અને 2 કાય્ય વ્યાકરણ પરિ. 4 મુજબ
ગણિત	ધોરણ - 7 (સેમ-1) Ch - 5 સમાંતર રેખાઓ Ch - 6 બહુપદીઓ ધોરણ - 7 (સેમ-2) Ch - 1 ધાત ધાતાંક Ch - 2 સાંદું વાજ ધોરણ - 8 (સેમ-1) Ch - 2 સંમેય ધાતાંક Ch - 6 ચતુર્ભોજા ધોરણ - 8 (સેમ-2) Ch - 3 કામ અને મહેનતાણું Ch - 4 અવયવીકરણ-1	ધોરણ - 9 Ch - 1 ગણકિયા Ch - 3 બહુપદી Ch - 5 દિશલ સુરેખ સમીકરણ Ch - 11 સમાંતરબાજુ ચતુર્ભોજા અને ત્રિકોણા ક્ષેત્રફળ Ch - 12 વર્તુળ Ch - 14 હેરોનનું સૂત્ર Ch - 15 પૃષ્ઠફળ અને ઘનફળ Ch - 16 આંકડાશાસ્ત્ર	ધોરણ - 10 Ch - 3 દિશલ સુરેખ સમીકરણ - પુંમ Ch - 4 દિશાત સમીકરણ Ch - 5 સમાંતર શ્રેણી Ch - 6 ત્રિકોણાની સમરૂપતા Ch - 7 સમરૂપતા અને પાયથાગોરસ Ch - 9 ત્રિકોણમિતી Ch - 13 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ
વિજ્ઞાન	ધોરણ - 7 (સેમ-1) Ch - 1 ચુંબકના ગુણધર્મો Ch - 7 ગતિ, બળ અને જડપ ધોરણ - 7 (સેમ-2) Ch - 7 તત્ત્વ-સંયોજન-મિશ્રણ Ch - 12 પોષણશ્રેણી અને આહારકીય ધોરણ - 8 (સેમ-1) Ch - 3 આધુનિક ખેતી Ch - 5 ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવીશ્રંખિ ધોરણ - 8 (સેમ-2) Ch - 2 આણિવ્ય રચના Ch - 5 પ્રજનનતંત્ર અને ઉત્સર્જનતંત્ર	ધોરણ - 9 ભાગ - 1 Ch - 3 ગુરૂત્વાકર્ષણ બળ Ch - 5 પરમાણૂ બંધારણ Ch - 8 પ્રાણીપેશી Ch - 9 આપણે શા માટે માંદા પડીએ છીએ ? ધોરણ - 9 ભાગ - 2 Ch - 2 તરંગગતિ અને ધવનિ Ch - 5 રાસાયણિક પ્રક્રિયા Ch - 7 સજીવોમાં વિવિધતા - 2 Ch - 8 નૈસર્જિક સંપત્તિ	ધોરણ - 11 Ch - 2 પ્રકાશ : પરાવર્તન અને વક્ષિભવન Ch - 4 વિદ્યુત Ch - 6 ખ્રબાંડ Ch - 7 એસિડ બેઇઝ અને ક્ષાર Ch - 11 કાર્બનિક સંયોજન Ch - 13 સજીવોમાં વહન, પરિવહન અને ઉત્સર્જન Ch - 16 આનુવંશિકતા અને ઉત્કાંતિ Ch - 18 નૈસર્જિક સ્ત્રોતોની જાળવણી

સામજીક વિજ્ઞાન	ધોરણ – 7 સેમે. – 1 માંથી 1, 2, 4, 5, 6 સેમે. – 2 માંથી 1, 2, 4, 5, 9	ધોરણ – 8 સેમે. – 1 માંથી 1, 2, 4, 5, 6 સેમે. – 2 માંથી 1, 2, 3, 5, 6	ધોરણ – 9 પાઠ – 1, 2, 3, 5, 6, 13, 15, 16, 17, 18
નામાના મૂળત વો	ધોરણ – 11 ભાગ – 1	ધોરણ – 11 ભાગ – 2 પ્રકરણ – 1, 2, 3, 5, 8, 11	ધોરણ – 12 ભાગ – 1 પ્રકરણ – 1,3 ભાગ – 2 પ્રકરણ – 1,4,5,6
અર્થશાસ્ત્ર	ધોરણ – 11 પ્રકરણ – 1 થી 5	ધોરણ – 11 પ્રકરણ – 6 થી 11	ધોરણ – 12 પ્રકરણ – 1 થી 6
વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન	ધોરણ – 11 પ્રકરણ – 1 થી 6	ધોરણ – 11 પ્રકરણ – 7 થી 11	ધોરણ – 12 પ્રકરણ – 1 થી 7

નોંધ :

- ધોરણ – 7, 8, 9, 10, 11 અને 12નો અભ્યાસક્રમ એટલે પ્રત્યેકમાં સમગ્ર વર્ષનો બંને સેમેસ્ટર/ભાગનો અભ્યાસક્રમ સમજવો અને જ્યાં પ્રકરણનો ઉલ્લેખ કરેલ છે ત્યાં જે-તે પ્રકરણ જ ગણવા.
- ભાષાનાં વિષયોમાં પરિશિષ્ટ મુજબનો વ્યાકરણનો સમાવેશ કરવો.
- ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ – ગાંધીનગર દ્વારા અભ્યાસક્રમમાં ફેરફાર થતાં બી.એડ. સેલ્ફ સ્ટડી કોર્સના અભ્યાસક્રમમાં ફેરફારને અવકાશ રહેશે.

પરિશિષ્ટ – ૧

ગુજરાતી વિષયવસ્તુ

- * પ્રશ્નપત્ર – કુલ ગુણ – 35 = વિષયવસ્તુ – 25 ગુણ + લેખન તથા વ્યાકરણ – 10 ગુણ

નોંધ : પૂરક વાચન અને સ્વ-અધ્યયનમાંથી પ્રશ્નો પૂછવા નહીં.

ગુજરાતી વ્યાકરણ અને લેખન

- * સેમેસ્ટર – I
 - સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો
 - જોડણી
 - સંયોજકો
 - શબ્દકોશ અનુસાર શબ્દનો ક્રમ
 - વિરામચિહ્નનો
 - શબ્દ સમૂહ માટે એક શબ્દ
 - સંજ્ઞા અને તેના પ્રકારો
 - અર્થવિસ્તાર / વિચાર વિસ્તાર
- * સેમેસ્ટર – II
 - દ્વિવૃક્ત અને સ્વાનુકારી શબ્દો
 - સર્વનામ અને તેના પ્રકારો
 - વિશેષજ્ઞ અને તેના પ્રકારો
 - સમાસ અને તેના પ્રકારો
 - મુદ્રા પરથી વાર્તાલેખન અને શીર્ષક
- * સેમેસ્ટર – IV
 - રૂઢીપ્રયોગો અને કહેવતો
 - વાક્ય અને તેના પ્રકારો
 - પદ્ધક્રમ અને પદ-સંવાદ
 - અલંકાર અને તેના પ્રકારો
 - નિબંધલેખન

परिशिष्ट – २
हिन्दी विषयवस्तु

★ पाठ्यपुस्तक गुण : रक्षा

व्याकरण और लेखन : १०

सत्र - ९ कक्षा - ७ (प्रथम और द्वितीय सत्र)

सत्र - ८ कक्षा - ८ (प्रथम और द्वितीय सत्र)

सत्र - ३ कक्षा - ९ (प्रथम और द्वितीय सत्र)

स्व-अध्ययन विभाग से प्रश्नों का समावेश न करे।

★ सेमेस्टर - ९

- हिंजे शुद्ध कीजिये
- शब्दकोश अनुसार शब्दकम्
- मुहावरे और कहावते
- लिंग और वचन
- संज्ञा (अर्थ एवं भेद)
- समानार्थी - विरुद्धार्थी शब्द
- प्रारूप के आधार - कहानी लेखन

★ सेमेस्टर - ८

- शब्दसमूह के लिए एक शब्द
- विशेषण
- सर्वनाम
- उपसर्ग
- प्रत्यय

★ सेमेस्टर - ४

- विरामचिह्न
- किया के काल
- कारक
- कर्तुवाचक संज्ञा / भाववाचक संज्ञा
- समास
- निबंधलेखन / अहवाल (रिपोर्ट)

પરિશિષ્ટ – ઉ સંસ્કૃત વિષયવસ્તુ

- * પ્રશ્નપત્ર – કુલ ગુણ – $35 = \text{વિષયવસ્તુ} - 25 \text{ ગુણ} + \text{લેખન તથા વ્યાકરણ} - 10 \text{ ગુણ}$

નોંધ : પૂરક વાચન અને સ્વ-અધ્યયનમાંથી પ્રશ્નો પૂછવા નહીં.

ગુજરાતી વ્યાકરણ અને લેખન

* સેમેસ્ટર – I

- વર્તમાન પરસ્પેપદના રૂપો
- પ્રશ્ન વાક્યો
- એકવચન / બહુવચન
- સંધી – જોડો અને છોડો
- સમય
- સંખ્યા – ૧ થી ૫૦

* સેમેસ્ટર – II

- ભૂતકાળ / ભવિષ્યકાળ
- ઘાતુના રૂપાભ્યાનો બનાવો
- ક્રિયાપદ આધારિત શબ્દો
- પ્રશ્નવાક્ય બનાવો
- સમાનાર્થી / વિરુદ્ધાર્થી
- શબ્દો પરથી વાક્ય બનાવો
- સંધી
- અવ્યય
- સબંધક ભૂતકૃદંત – હેત્વર્થ, વિધર્થ
- સમય
- સંખ્યા ૧ થી ૧૦૦
- વર્ણપટ
- વિભક્તિ પરિચય
- સર્વનામ
- નામપદ / ક્રિયાપદ
- પુરુષ – વચન
- ગાણ પરિચય – પ્રથમ ત્રણ સમૂ' ૧, ૪, ૬ અને ૧૦
- સામાસિક શબ્દો

* સેમેસ્ટર – IV

અભ્યાસ – ૪ થી ૭

પાઠ – ૧ થી ૧૦

પરિશીલન – ૪
ENGLISH CONTENT

*** SEMESTER – 1**

- STANDARD 7 (SEM I AND II) TEXT BASED QUESTIONS : 25 MARKS
(20 MARKS TEXT BASED + 5 MARKS TASK / ACTIVITIES SUGGESTED IN THE TEXTBOOK)
- GRAMMER AND COMPOSITION BASED QUESTIONS : 10 MARKS
(QUESTIONS FROM FOLLOWING POINTS)
 - ◆ PAPER OF SPEECH ◆ TENSES
 - ◆ PUNCTUATION ◆ WORD FORMATION
 - ◆ ARTICLES ◆ QUESTION TAG
 - ◆ TYPES OF PRONOUNS
- COMPOSITION POINTS
 - ◆ DILOGUE WRITING ◆ LETTER WRITING
 - ◆ COMPREHENSION (UNSEEN PASSAGE)

*** SEMESTER – 2**

- STANDARD 8 (SEM I AND II) TEXT BASED QUESTIONS : 25 MARKS
(20 MARKS TEXT BASED + 5 MARKS TASTK / ACTIVITIES SUGGESTED IN THE TEXTBOOK)
- GRAMMAR AND COMPOSITION BASED QUESTIONS : 10 MARKS
(QUESTIONS FROM FOLLOWING POINTS)
 - ◆ CONJUNCTIONS ◆ PREPOSITION
 - ◆ ACTIVE-PASSIVE VOICE ◆ CAUSAL VERBS
 - ◆ MODAL AUXILIARIES ◆ DEGREES OF COMPARISON
- COMPOSITION POINTS
 - ◆ ESSAY WRITING
 - ◆ STORY WRITING
 - ◆ COMPREHENSION (UNSEEN PASSAGE)

*** SEMESTER – 4**

- STANDARD 9 (SEM I AND II) TEXT BASED QUESTIONS : 25 MARKS
(20 MARKS TEXT BASED + 5 MARKS TASTK / ACTIVITIES SUGGESTED IN THE TEXTBOOK)
- GRAMMAR AND COMPOSITION BASED QUESTIONS : 10 MARKS
(QUESTIONS FROM FOLLOWING POINTS)
 - ◆ DIRECT – INDIRECT SPEECH
 - ◆ CLAUSES AND PHRASES
 - ◆ TRANSFORMATION OF SENTENCES
 - ◆ SYNTHESIS
- COMPOSITION POINTS
 - ◆ APPLICATION WRITING
 - ◆ REPORT WRITING
 - ◆ COMPREHENSION (UNSEEN PASSAGE)

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી બી.એડ. પ્રશ્નપત્ર માળખુ

70 ગુણાના પ્રશ્નપત્રનું માળખું

ક્રમ	ગુણ (1 પ્રશ્નના)	પ્રશ્નની સંખ્યા	ઉત્તર આપવાના પ્રશ્નો	ગુણ (વિકલ્પ સાથે)	ગુણ (વિકલ્પ વિના)
1	01	10	10	10	10
2	02	12	10	24	20
3	40	07	06	28	24
4	08	03	02	24	16
	કુલ	32	28	86	70

- પ્ર.1 નીચેના પ્રત્યેક પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. ગુણ – 10
 પ્ર.2 નીચેના પ્રશ્નોમાંથી કોઈપણ 10 પ્રશ્નોના જવાબ લખો. (12 માંથી 10) ગુણ – 20
 પ્ર.3 નીચેના પ્રશ્નોમાંથી કોઈપણ 06 પ્રશ્નોના જવાબ લખો. (7 માંથી 6) ગુણ – 24
 પ્ર.4 નીચેના પ્રશ્નોમાંથી કોઈપણ 02 પ્રશ્નોના વિસ્તૃત જવાબ લખો. (3 માંથી 2) ગુણ – 16
 કુલ ગુણ – 70

35 ગુણાના પ્રશ્નપત્રનું માળખું

ક્રમ	ગુણ (1 પ્રશ્નના)	પ્રશ્નની સંખ્યા	ઉત્તર આપવાના પ્રશ્નો	ગુણ (વિકલ્પ સાથે)	ગુણ (વિકલ્પ વિના)
1	01	05	05	05	05
2	02	06	05	12	10
3	04	06	05	24	20
	કુલ	17	15	41	35

- પ્ર.1 નીચેના પ્રત્યેક પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. ગુણ – 05
 પ્ર.2 નીચેના પ્રશ્નોમાંથી કોઈપણ 05 પ્રશ્નોના જવાબ લખો. (6 માંથી 5) ગુણ – 10
 પ્ર.3 નીચેના પ્રશ્નોમાંથી કોઈપણ 04 પ્રશ્નોના વિસ્તૃત જવાબ લખો. (6 માંથી 5) ગુણ – 20
 કુલ ગુણ – 35